



BHARUCH ANKLESHWAR URBAN DEVELOPMENT AUTHORITY

PART PLAN OF DEVELOPMENT PLAN OF BAUDA AS SANCTIONED WITH MODIFICATION VIDE GOVERNMENT NOTIFICATION NO. GH/V/54 of 2017/DVP -202013 -4903-L: DT. 28 - 03 - 2017 UNDER SECTION 17-(C)(1) & ITS CORRIGENDUM NO. GH/V/102 OF 2017/DVP-202013 -4903-L: DT. 26 - 05 - 2017. OF GTP & UD ACT, 1976.

ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-૧૯૭૬ ની કલમ -૧૭(સી)(૧) હેઠળ તા.૨૮/૦૩/૨૦૧૭નાં જાહેરનામાં ક્રમાંક : જીએચ/વી/૫૪નો ૨૦૧૭/ડીવીપી- ૨૦૨૦૧૩-૪૯૦૩-લ તથા તા.-૨૬/૦૫/૨૦૧૭ના સુધારા હેઠળના જાહેરનામા ક્રમાંક : જીએચ/વી/૧૦૨ નો ૨૦૧૭/ ડીવીપી-૨૦૨૦૧૩-૪૯૦૩-લ થી સરકારશ્રી દ્વારા મંજૂર કરેલ આખરી વિકાસ યોજના મુજબ આ વિભાગીય નકશો છે.


નોંધ :- જમીનના રે. સ. નંબર/હદ/માપ/ક્ષેત્રફળ /સ્થળ સ્થિતિ વિગેરે બાબતે અધિકૃત દફતર માન્ય રહેશે.

R. S. No.:- 172

VILLAGE:- JHADESHWAR

TALUKA:- BHARUCH

DISTRICT:- BHARUCH



નોંધ:- અંતિમ ખંડ નં:- ની હદ, માપ, ક્ષેત્રફળ, સ્થળ - સ્થિતિ તથા પ્રવેશી રસ્તા સરકારશ્રી દ્વારા આખરી મંજૂર થઇ અમલી બનેલ અંતિમ નગર રચના યોજના નં:- (ભરૂચ) મુજબ ધ્યાને લેવાની રહેશે.

LEGEND

- VILLAGE BOUNDARY
- EXISTING ROADS
- WATER COURSE AND TALAV
- RESIDENTIAL ZONE-1
- RESIDENTIAL ZONE-2

60 M. WIDE PROPOSED ROADS

MODIFIED LEGEND

- CANCELED ROAD ALIGNMENT
- MODIFIED 30 MT WIDE ROAD ALIGNMENT
- MODIFIED 24 MT WIDE ROAD ALIGNMENT
- RESIDENTIAL ZONE-2

PREPARED BY

S.H. Rana
17/3/18
0-18

CHECKED BY

R.P.P.
JHB

CHECKED BY
PLANNING ASSISTANT

R.P.P.
JHB



TRUE COPY

[Signature]

JUNIOR TOWN PLANNER
BAUDA, BHARUCH

N



Date :- 17/03/2018



Scale 1:8000



ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ

જુની કલેક્ટર ઓફીસ, કણબીવગા, ભરૂચ

ફોન નં.(૦૨૬૪૨) ૨૨૨૦૭૫, ૨૨૨૦૭૪, ૨૨૨૦૭૩

Email :- ceo.bauda@gmail.com

ક્રમાંક : બોડા/ઝોનિંગસર્ટીફિકેટ/વશી/

તા.૧૭/૦૩/૨૦૧૮

પ્રતિ,

શ્રી ભાવેશભાઈ દેસાઈ


વિષય :- મોજે. ઝાડેશ્વર, તા.ભરૂચ, જિ. ભરૂચ ના રે.સ.નં. ૧૭૨ વાળી જમીનના મંજૂર વિકાસ યોજનાની દરખાસ્ત મુજબ પાર્ટ પ્લાન(વિભાગીય નકશો) તથા ઝોનિંગ સર્ટીફિકેટ આપવા બાબત.

સંદર્ભ :- આપશ્રીની તા.૧૭/૦૩/૨૦૧૮ ની અરજી અન્વયે.

ઉપરોક્ત વિષયે જણાવાનું કે મોજે. ઝાડેશ્વર તા. ભરૂચ જિ. ભરૂચ ના રે.સ.નં. ૧૭૨ વાળી જમીન ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ ૧૯૭૬ ની કલમ-૧૭(સી)(૧) હેઠળ તા. ૨૮/૦૩/૨૦૧૭ ના જાહેરનામાં ક્રમાંક : જીએચ/વી/૫૪નો ૨૦૧૭/ડીવીપી-૨૦૨૦૧૩-૪૯૦૩-લ તથા તા. ૨૬/૦૫/૨૦૧૭ ના સુધારા હેઠળના જાહેરનામાં ક્રમાંક : જીએચ/વી/૧૦૨નો ૨૦૧૭/ડીવીપી-૨૦૨૦૧૩-૪૯૦૩-લ થી સરકારશ્રી દ્વારા મંજૂર થઈ અમલી બનેલ વિકાસ યોજનાની દરખાસ્ત મુજબ રે.સ.નં.૧૭૨ વાળી જમીન રહેણાંક ઝોન - ૨ માં આવે છે (As Per Modification Schedule No. 21 POCKET - 21 R1 to R2) અને દક્ષિણ દિશા તરફ ૩૦.૦૦ મીટર પહોળા સુચિત રસ્તાની અસર થાય છે. (As Per Modification Schedule No. 58)

નોંધ :- જમીનના રે.સ.નં./હદ/માપ/ક્ષેત્રફળ/સ્થળ સ્થિતિ વિગેરે બાબતે અધિકૃત દફતર માન્ય રહેશે.




જુનીયર ટાઉન પ્લાનર
ભરૂચ-અંકલેશ્વર શહેરી વિકાસ સત્તા મંડળ
ભરૂચ